

B.Com. Semester - 6 (CBCS) Examination
April/May-2022 (OLD COURSE)
CORPORATE TAX PLANNING -2(DSE-1)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

-
- પ્રશ્ન-૧ લિક્વિડેશનનાં સમયે મિલકતોનાં વિતરણનાં સંદર્ભ સાથે કોર્પોરેટ ટેક્સ પ્લાનીંગ ઉદાહરણ સાથે સમજાવો. (૨૦)
- અથવા
- પ્રશ્ન-૧ કામદારોનાં મહેનતાણાનાં સંદર્ભ સાથે કોર્પોરેટ ટેક્સ પ્લાનીંગ ઉદાહરણ સાથે સમજાવો.
- પ્રશ્ન-૨ વીમા વળતરની રીસીપ્ટ સંદર્ભ સાથે ઉદાહરણ સાથે કોર્પોરેટ ટેક્સ પ્લાનીંગ સમજાવો. (૨૦)
- અથવા
- પ્રશ્ન-૨ વૈજ્ઞાનિક સંશોધન મિલકતોનાં વેચાણનાં સંદર્ભ સાથે ઉદાહરણ સાથે કોર્પોરેટ ટેક્સ પ્લાનીંગ સમજાવો.
- પ્રશ્ન-૩ સમજાવો: (૧) એડવાંસ રુલીંગ્સ (૦૮)
- (૨) ડબલ ટેક્સેશન રિલિફ (૦૭)
- અથવા
- પ્રશ્ન-૩ ફેરબદલી કિંમત નિર્ધારણ નિયમન જોગવાઈ વિશે સમજાવો.
- પ્રશ્ન-૪ વિસર્જન સંદર્ભ સાથે કોર્પોરેટ ટેક્સ પ્લાનીંગ સમજાવો. (૧૫)
- અથવા
- પ્રશ્ન-૪ શાસક અને ગૌણ કંપનીઓ સાથે મિલકતોની ફેરબદલી વિશે સમજાવો.

ENGLISH VERSION

- Que-1 Explain Corporate Tax Planning with reference to distribution of assets at the time of Liquidation with example. (20)
- OR
- Que-1 Explain Corporate Tax Planning with reference to Employees remuneration with Example. (20)
- Que-2 Explain Corporate Tax Planning with reference to receipt of Insurance compensation with example. (20)
- OR
- Que-2 Explain Corporate Tax Planning with reference to sale of scientific research assets with Example. (20)
- Que-3 Explain: (1) Advance Rulings (2) Double Taxation Relief (08)
- OR (07)
- Que-3 Explain about provisions regulating Transfer pricing. (15)
- Que-4 Explain Corporate Tax Planning with reference of Demerger. (15)
- OR
- Que-4 Explain about Transfer of assets between holding and Subsidiary companies. (15)
